

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૬/૧૨/૨૦૨૧ થી તા.૧૨/૧૨/૨૦૨૧ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય:-

- (૧) ઉદ્યોગનગર પો.સ્ટે. જા.જોગ નં.૨૪/૨૧ તા.૨૭/૧૧/૨૦૨૧ ના રોજ ગુમ થનાર સેજલબેન ડો/ઓ કેશુભાઈ ભાદરવડા ઉ.વ.૧૯ રહે. બોખીરા, તુંબડા, પોરબંદરને ઉદ્યોગનગર પો.સ્ટે. પો.સબ.ઈન્સ.શ્રી એમ.બી.કારાવદરા નાઓએ તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ આદિત્યાણા ગામથી શોધી કાઢેલ છે.
- (૨) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૪૧/૨૧ તા.૦૭/૧૦/૨૦૨૧ ના રોજ ગુમ થનાર તૃપ્તિબેન ડો/ઓ પરબતભાઈ સોલંકી ઉ.વ.૧૯ રહે. વિજયપુર ગામ તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકાને એલ.સી.બી. પો.હેડ કોન્સ. કે.આર.જાડેજા તથા સ્ટાફ દ્વારા તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ અણીયારી ગામથી શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય :-

- (૧) ઉદ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૮૦૧૦૨૧૦૭૪૪/૨૦૨૧ IPC ક.૪૪૭, ૩૭૯ મુજબના ગુન્હાના કામના કોઈ અજાણ્યા ચોર ઈસમે આ કામના ફરિયાદીના ભાડાના મયુર ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના કમ્પાઉન્ડમાં અંદર પ્રવેશ કરી ફરિયાદીના સોડા એશ માલની બોરીઓમાંથી સોડા એશના માલની ૫૦ કિલો વજનની કુલ-૩૪૦ પ્લાસ્ટિકની બોરીઓ, જેનો કુલ વજન-૧૭ ટન માલ, જેની કુલ કિ.રૂ.૨,૩૧,૨૦૦/-ની ચોરી કરી લઈ જઈ ગુન્હો નોંધાયેલ જે અંગે ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ.શ્રી તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા તપાસ દરમિયાન ચોરીમા સંડોવાયેલ આરોપી મનિષ ચનાભાઈ બોરસીયા ઉ.વ.૩૮ રહે.હાલ આશાપુરા ચોક, રમણપાર્ક, મામાના મંદિરવાળી ગલીમાં, મુળ રહે.ખાપટ ગામ, જુની પંચાયત ઓફિસની બાજુમાં, પોરબંદરને તા.૧૦/૧૨/૨૧ ના ક.૧૯/૦૦ વાગ્યે અટક કરેલ. ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરી ગુન્હો ડિટેક્ટ કરી સારી કામગીરી કરેલ.

મુદ્દા નંબર ૫:- વૃધ્ધો મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી:-

- (૧) તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી એન.જે.રાવલ તથા “ She ” ટીમના કર્મચારીઓ દ્વારા ગોઢાણીયા સ્કુલના વિદ્યાર્થીઓને સ્વંય સુરક્ષા અંગેની સમજ આપવામાં આવેલ. તેમજ તા.૦૯/૧૨/૨૦૨૧ ના રોજ કમલાબાગ ગાર્ડનમાં માતાઓને “ સમજ સ્પર્શ કી ” અંગે બાળકો પ્રત્યે જાગૃત રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
- (૨) તા.૦૬/૧૨/૨૦૨૧ થી તા.૧૨/૧૨/૨૦૨૧ દરમિયાન હાર્બર મરીન પોલીસ સ્ટેશનના “ She ” ટીમના કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કંપનીમાં કામે આવતી મહીલાઓની તથા જાવરમાં આવેલ સ્કુલનાં વિદ્યાર્થીઓની તથા સીનીયર સીટીઝનની મુલાકાત લઈ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર